#### MEHTA HOUSING FINANCE LIMITED

**Regd. Off**: Plot No. 1A, Revenue Survey No 203, Savarkundla Road, Taveda, Mahuva Bhavnagar, Gujarat - 364290

**CIN**: L15100GJ1993PLC020699 **M**: 98989 08652

Email: mehtahousingfinanceltd@gmail.com Website: www.mehtahousing.com

Date: 06.12.2024

To, General Manager, The Department of Corporate Services - CRD, BSE Limited, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai – 400 001

Dear Sir/Madam,

**Scrip Code: 511740** 

## <u>Sub: Newspaper Advertisement - Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015</u>

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, We hereby enclose copies of the newspaper advertisement informing about Postal Ballot Notice and e-Voting information published in Lokmitra and Financial Express.

You are requested to kindly take the above information on record.

Thanking you.

Yours faithfully,

For Mehta Housing Finance Limited

Khyati Gandhi Company Secretary & Compliance Officer Membership No.: A62422 લોકમિત્ર, LOKMITRA

# વિધાનસભા નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઇ પર્યાવરણને થતા નુકસાન માટે ગ્લોબલ સાઉથ જવાબદાર નથી, ભાગીદાર પટેલના હસ્તે આહવામાં ઈ - રીક્ષા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

# આહવા તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોમાં કુલ ૧૭ ઈ - રીક્ષાઓનું લોકાર્પણ કરાયું



ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભા નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે આહવા તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતમાં કુલ ૧૭ ઈ - રીક્ષાઓનું લોકાર્પણ કરાયું હતું.

આ પ્રંસગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બનાવવાનો છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્વછતા જાળવવા ઈ -રીક્ષાઓ પંચાયતને આપવામાં આવી છે.

જાગૃત બની ઈ - રીક્ષાનો ઉપયોગ કરે તે હિતાવહ છે. વધુમાં આજે લોકાર્પણ થઈ રહેલી ઈ -રીક્ષાના ઉપયોગ અને તે અંગેની ચર્ચા ગ્રામજનો સાથે કરવામાં આવે તે માટે જે અંતર્ગત આજરોજ આહવા શ્રી વિજયભાઈ પટેલે સરપંચશ્રીઓને તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોમાં કુલ અનુરોધ કર્યો હતો. સાથે જ સરપંચ ૧૭ ઈ-રીક્ષા લોકાર્પણ કરવામાં તરીકે પોતાની ફરજ નિભાવી આવી છે. જેમાં આહવા, શામગહાન, ગામમા વીજળી પાણીની સુવિધા છે ગલકુંડ, પિંપરી, કે નહીં તે અંગે વ્યવસ્થા ઉભી કરવી દિવાનટેબરુન, તેમજ ગામમાં સ્વછતા બાબતે ધ્યાન ભવાનદગડ. આપી વિકાસકીય નાના-મોટા કામોનું ગોટીયામાળ, માલેગામ, બોરખલ, એક્શન પ્લાન બનાવી ગ્રામ ધવલીદોડ ગામમાં ઈ - રીક્ષાની પંચાયતને આદર્શ ગ્રામ પંચાયત ફાળવણી કરવામાં આવી છે. આહવા બનાવવાની અપીલ પણ સરપંચશ્રીઓને કરવામાં આવી હતી.

આપણો જિલ્લો પણ સ્વછતા શૌચાલય મુક્ત બની રહે તે માટે સ્વછતા અભિયાનમાં જોડાવા લોકોને અનુરોધ કર્યો હતો.

તેમજ આજે આહવા તાલુકામાં લોકાર્પણ થયેલ ઈ- રીક્ષાઓ ગ્રામ પંચાયતનું ઘરેણું છે જે સ્વછતા બાબતે વધુ ઉપયોગી થશે તેમ શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ તેથી તમામ લોકો સ્વછતા બાબતે શ્રીમતી નિર્મળાબેન ગાઈને જણાવ્યું હતું કે, જિલ્લાના આહવા તાલુકામાં – ૧૭, સુબીર તાલુકામાં – ૧૧ અને વઘઈ તાલુકામાં – ૧૧ કુલ ૩૯ ઈ-રીક્ષાની ખરીદી કરવામાં આવેલ છે. ગાઢવી, ચિંચલી. ચિકટિયા,

કચરા વ્યવસ્થાપન માટે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જે અનુસંધાને ગામના તમામ જાહેર જગ્યાઓ દેખીતી રીતે સ્વચ્છ દેખાય તે માટે ઘેર ઘેરથી નીકળતો સૂકો અને ભીનો કચરો એકત્ર કરવા તેમજ ગામોમાં ભરાતા હાટ બજારમાંથી નીકળતા કચરાના નિકાલ કરવા માટે વધુ ઘરો ધરાવતી ગ્રામ પંચાયતો માટે સામાન્ય પરંતુ અલગ-અલગ વાહનોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી ડાંગ જિલ્લામાં ઈ - રીક્ષાની ફાળવણી કરવામાં આવી છે.

પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, જિલ્લા છે. પંચાયત આરોગ્ય સમિતિ અધ્યક્ષા શ્રીમતી મયનાબેન બાગુલ, જિલ્લા સદસ્ય શ્રીમતી નિલમબેન ચૌધરી, આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદભાઈ ભોયે, ઉપ કરેછે. સત્રમાં ઉલ્લેખિત સામાન્ય સરપંચ શ્રી હરિરામ સાવંત સહિતના પદાધિકારીશ્રીઓ, ખાતે આયોજિત કાર્યક્રમમાં ૫ નાયબ જિલ્લા વિકાસ અધિકારી લાભાર્થીઓને શૌચાલયના પ્રમાણપત્ર શ્રી હિરલ પટેલ, હિસાબી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એનાયત કરવામાં આવ્યાં હતાં. અધિકારી શ્રી આર. બી. ચૌધરી સમગ્ર ભારત શૌચાલય મુક્ત ઉલ્લેખનીય છે કે, સ્વચ્છ ભારત સહિત ના અધિકારીશ્રીઓ તેમજ બનાવવાની પહેલ કરી છે ત્યારે મિશન – ગ્રામીણ ફેઝ-૨ અંતર્ગત ઘન ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

નથી, પરંતુ તે વિકસિત દેશો દ્વારા થયું છે જેમણે ઓછા ખર્ચે ઉર્જાનો લાભ માણ્યો હતો. કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) પાર્ટનરશિપ સમિટ ૨૦૨૪ના ઉદ્ઘાટન સત્રને સંબોધન દરમિયાન આ વાત કહી હતી. આ સમિટમાં ઇટાલિયન રિપબ્લિક, ઇઝરાયલ, ભૂતાન, બહેરીન, અલ્જીરિયા, નેપાળ, સેનેગલ, દક્ષિણ આફ્રિકા, મ્યાનમાર, કતાર અને કમ્બોડિયા સામ્રાજ્યના વાણિજ્ય મંત્રાલયના વિદેશ મંત્રીના વેપાર મંત્રીઓ ભાગીદાર દેશો હતા.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે, દરેક ભાગીદાર દેશોએ પર્યાવરણ અને સ્થાયીત્વ પ્રત્યે સહિયારી જવાબદારીઓ સહિયારી છે, પણ સમિટમાં ઉપસ્થિત દેશો પર્યાવરણને થયેલા નુકસાન માટે જવાબદાર નથી. તેથી, સહિયારી સપ્લાય ચેઇન અને ટકાઉપણા પ્રત્યેની જવાબદારીઓ જવાબદારી દ્વારા પૂરી કરવી પડશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે બધાએ સાથે મળીને આ પ્રંસગે આહવા તાલુકા કામ કરવાનું છે, ત્યારે પર્યાવરણીય સમસ્યામાં દરેકને તેમના પ્રદાનના આધારે જવાબદારી આપવાની જરૂર

સહભાગીઓને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે, ભારત ગ્લોબલ સાઉથનાં દેશોને મૈત્રીપૂર્ણ અને ભાગીદારીનો વિશ્વસનીય હાથ પ્રદાન થીમ્સ શેર કરતા, તેમણે ધ્યાન દોર્યું હતું કે સ્થિરતા, અવકાશ, ઉપગ્રહ અને ટકાઉપણાની સૌથી વધુ ચર્ચા ઉપસ્થિત અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે વિશ્વને આ ચર્ચાઓની

પર્યાવરણીય નકસાન માટે જવાબદાર (એ આઇ) અને ઓટો મેશન રોજગારીનાં ભવિષ્ય અને બદલાતી રોજગારીની પ્રોફાઇલને અનુકૂળ થવા જરૂરી કૌશલ્યો પર અસર કરશે. તેમણે કહ્યું હતું કે, ટેકનોલોજી જીવનની કાયાપલટ કરશે અને આજીવિકાની પ્રકૃતિમાં પરિવર્તન લાવશે, પણ પરંપરા અને સંસ્કૃતિને સમાનરીતે જાળવવાની જરૂર પડશે. તેથી, તે એક તરફ પરંપરા અને વારસો અને બીજી તરફ તકનીકીનું મિશ્રણ હોવું જરૂરી છે, એમ તેમણે

> તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકો અને પ્રક્રિયાઓ એમ બંનેનું સશક્તિકરણ વૃદ્ધિ માટે ચાવીરૂપ છે. ભારત ઉચ્ચ આકાંક્ષાઓ ધરાવતા યુવાનોના વિશાળ ભંડાર સાથે આગળ વધી રહ્યું છે એ બાબત તરફ ધ્યાન દોરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવતીકાલના પડકારોનો સામનો કરવા માટે તેમને શિક્ષણ અને કૌશલ્ય સાથે સશક્ત બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, તેનાથી વેપાર-વાશિજયમાં સરળતા અને જીવનની સરળતા ઊભી થશે.

નોંધ્યું હતું.

ભાગીદાર દેશોના અર્થતંત્રને મજબૂત બનાવવા અંગે બોલતા મંત્રીશ્રીએ ભવિષ્યને ભંડોળ પૂરું પાડવા નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા તરલતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ અંગે વધુ જણાવતાં મંત્રીએ નોંધ્યું હતું કે, જીવનશૈલીની સાથે તરલતા પર વધારે ઊંડા ચિંતનની જરૂર છે. વપરાશનો કચરો વિશ્વને રહેવા માટે વધુ સારી જગ્યા બનાવશે નહીં અને વિશ્વએ જીવનશૈલી અને સર્ક્યુલર ઇકોનોમી પર ચિંતન કરવું પડશે, તેમણે ઉમેર્યું હતું કે સારી જીવનશૈલીના લક્ષ્યને આગળ ધપાવતી વખતે આપણે કચરા અને કાર્બન ફ્ટપ્રિન્ટ વિશે સભાન રહેવું પડશે જે આપણે છોડીએ છીએ. મંત્રીએ ઉમેર્યું હતું કે, વપરાશની પેટર્નને અંકુશમાં લેવાની જરૂર છે

દેશોએ ટકાઉપણા પ્રત્યેની જવાબદારીઓ વહેંચી છેઃ શ્રી પિયુષ ગોયલ શ્રી ગોયલે જણાવ્યું હતું કે, અને પર્યાવરણીય પડકાર એ ઉત્પાદન ગ્લોબલ સાઉથ વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મારફતે ઉત્સર્જિત થતા કાર્બનનું કાર્ય નથી. તેમણે કહ્યું કે આ મદાને વપરાશને કારણે થતાં કાર્બન ફૂટપ્રિન્ટના કાર્ય તરીકે જોવાની જરૂર

> પોતાનાં સંબોધન દરમિયાન શ્રી ગોયલે દુનિયાભરની તમામ વિકાસલક્ષી પ્રવૃત્તિઓનાં હાઈમાં સર્વસમાવેશકતા વિશે વાત કરી હતી. શ્રી ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવીનતા, ઉદ્યોગ, માળખાગત સુવિધા, રોકાણ અને પહેલથી દેશોને ઝડપથી સર્વસમાવેશક બનવામાં મદદ મળશે.

મં ત્રીએ વૃદ્ધિ સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવા ભાગીદાર દેશો વચ્ચે વૈશ્વિક વેપાર અને પર્યટન વધારવાની જરૂરિયાત પર પણ વાત કરી હતી. તેમણે ઊર્જા, વિશ્વમાં આર્થિક વિકાસમાં ચાલકબળ અને એકમાત્ર ફાળો આપનાર પર પણ ભાર મૂક્યો હતો. ઊર્જા ભવિષ્ય નક્કી કરશે, એમ તેમણે કહ્યું હતું.

શિખર સંમેલનનો ઉલ્લેખ કરતાં મંત્રીએ નોંધ્યું હતું કે, ભાગીદાર દેશો વચ્ચે સમન્વય સ્થાપિત થવાથી દુનિયાને એકતાનો સંદેશો મળી શકે

વપરાશનો કચરો ગ્રહને નુકસાન પહોંચાડી રહ્યો છે, વિશ્વએ જીવનશૈલી પર વિચાર કરવાની જરૂર છેઃ શ્રી ગોયલ

ૈવૈશ્વિક વેપાર, પ્રવાસન વધારવા માટે ભાગીદાર દેશોએ કામ કરવું જોઈએઃ શ્રી ગોયલ

· ભાગીદાર દેશો વચ્ચે સંકલન વિશ્વને એકતાનો સંદેશ આપશેઃ શ્રી ગોયલ

છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રહી છે, તેના માટે તેમને પ્રોત્સાહન મુત્સદ્દીગીરીની તરફેણમાં ઊભું રહ્યું ભૂ-રાજકીય પડકારોનો સામનો કરી ભાર મૂક્યો હતો.

ભારત હંમેશા શાંતિ. સંવાદ અને આપવું પડશે. વધુમાં. તેમણે ભાગીદાર દેશોએ સામાન્ય શાંતિ છે, જેનું સૂચન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર અને સમૃદ્ધિ માટે એકબીજાના હિતોને મોદીએ કર્યું હતું, અત્યારે દુનિયા જે સંરેખિત કરવાની જરૂરિયાત પર

## ભારત NCX 2024 અભૂતપૂર્વ સફળતા સાથે પૂર્ણ થયું

### ૬૦૦થી વધુ સહભાગીઓને તાલીમ આપવામાં આવી, મુખ્ય પહેલ શરૂ કરવામાં આવી અને નવીનતાઓ દર્શાવવામાં આવી

નવી દિલ્હી, ભારત નેશનલ નિર્માતાઓ, સંરક્ષણ કર્મચારીઓ, સ્ટાર્ટઅપ પ્રદર્શને વ્યૂહાત્મક ચર્ચાઓ સાયબર એક્સરસાઇઝ (NCX) ૨૦૨૪, જે ભારતના સાયબર સિક્યુરિટી લેન્ડસ્કેપમાં એક સીમાચિક્ષરૂપ ઘટના છે, તે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, જેણે સાયબર સ્થિતિસ્થાપકતા, સહયોગ અને નવીનતામાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. ૬૦૦થી વધુ સહભાગીઓને તાલીમ આપવામાં આવી છે, આ પહેલ ભારતની સાયબર સુરક્ષા તત્પરતાને સામૂહિક રીતે મજબૂત કરવા માટે સાયબર સુરક્ષા વ્યાવસાયિકો, નીતિ

શિક્ષણવિદો અને ઉદ્યોગના નેતાઓને એકસાથે લાવ્યા છે.

દર્શાવવામાં આવ્યા હતાઃ ડીજી એનસીઆઈઆઈપીસી દ્વારા નેશનલ સાયબર સિક્યુરિટી રેફરન્સ ફ્રેમવર્કનું લોન્ચિંગ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) દ્વારા સ્વદેશી રીતે વિકસિત ભારત નેશનલ સાયબર રેન્જ ૧.૦નું ઉદ્ઘાટન. આ પહેલોની સાથે, ભારત CISOs કોન્ક્લેવ અને BHARAT સાયબર સિક્યુરિટી સફળતા આપી હતી.

માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને સાયબર સુરક્ષામાં અદ્યતન નવીનતાઓનું આ ઇવેન્ટમાં બે મુખ્ય સીમાચિહ્નો પ્રદર્શન કર્યું હતું. સમાપન સમારંભ દરમિયાન, લેફ્ટનન્ટ જનરલ જોક્સન પી. મેથ્યુ, ચીક ઓક ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફે ભારતની ડિજિટલ સરહદોને સુરક્ષિત કરવા માટે એક મુખ્ય પહેલ તરીકે ભારત NCX 2024ના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સહયોગી ભાવનાને બિરદાવી જેણે ઇવેન્ટને જબરદસ્ત

### મહેતા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ

રજી.ઓફિસ: પ્લોટ નં. ૧એ, રેવન્યુ સર્વે નં. ૨૦૩, સાવરકુંડલા રોડ, તવેડા, મહુવા, ભાવનગર, ગુજરાત-૩૬૪૨૯૦ CIN: L15100GJ1993PLC020699 મો.: 98989 08652 ઇ-મેલ : mehtahousingfinanceltd@gmail.com વેબસાઇટ : www.mehtahousing.com પોસ્ટલ બેલેટની સૂચના અને રિમોટ ઇ-વોટિંગ અંગેની માહિતી

મહેતા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (કંપની) કંપની એક્ટની કલમ ૧૦૮ અને ૧૧૦ અનુસાર, ૨૦૧૩(અધિનિયમ)નિયમ સાથે કંપનીઝ (વહીવટ અને સંચાલન) રૂલ્સ. ૨૦૧૪ના નિયમ ૨૦ અને ૨૨ વાંચતા. સમયાંતરે સધારેલ નિયમો (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટેશન નિયમો). સામાન્ય પરિપત્ર નં.૦૯/૨૦૨૪ તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ અને અન્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા સંબંધિત પરિપત્રોના કોર્પોરેટ અફેર્સ (એમસીએ) સમય સમય પર (એમસીએ પરિપત્રો), અને સિક્યોરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના નિયમન ૪૪ (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસક્લોઝર રિક્વોયરમેન્ટસ)રેગ્યુલેશન્સ, ૨૦૧૫ (લિસ્ટીંગ રેગ્યુલેશન્સ) અને અન્ય લાગુ જોગવાઇઓના અધિનિયમ, નિયમો, લિસ્ટિંગ રેગ્યુલેશન્સ, પરિપત્રો અને તેના હેઠળ જારી કરાયેલ સુચનાઓ (કોઈપણ વૈધાનિક ફેરફાર (કોઈપણ), સ્પષ્ટતા(ઓ), અવેજી(ઓ) અથવા પુનઃ અધિનિયમ(મો) સહિત (જે ને સમયે લાગુ), નીચે જણાવેલા ઠેરાવો પોસ્ટલ બેલેટ દ્વારા વિશેષ ઠરાવો તરીકે માત્ર ઇલેકટ્રોનિક માધ્યમ(રિમોટ ઇ-વોટિંગ)દ્વારા પાસ કરવા માટે આથી

ક્રમ નં.	ઠરાવ	ઠરાવનો પ્રકાર
٩	કંપનીના નામમાં ફેરફાર	ખાસ ઠરાવ
ર	મેમોરેન્ડમ ઓફ એસોસિયેશન અને કંપનીના સંગઠનના આર્ટીકલ્સમાં ફેરફાર	ખાસ ઠરાવ

કંપનીએ પોસ્ટલ બેલેટની સૂચના સ્પષ્ટીકરણ નિવેદન સાથે કંપનીના સભ્યોને, એવા સભ્યો કે જેમણે પોતાનો ઇ-મેલ આઈડી કંપીનાન રજીસ્ટ્રાર અને શેર ટાન્સફર એજન્ટ (આરટીએ) એટલેકે પૂર્વા શેરજિસ્ટરી (ઇન્ડિયા) પ્રા.લિ. સાથે અને /અથવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કટ-ઓફ ડેટ નવેમ્બર ૨૯. ૨૦૨૪ ના રોજ નોંધાવેલ હોય તેવા તમામ સભ્યોને ઇ-મેલ દ્વારા રવાના કરવાનું કાર્ય ડિસેમ્બર ૪, ૨૦૨૪ના રોજ પૂર્ણ કરેલ છે.

ઉક્ત નોટિસ કંપનીની વેબસાઇટ www.mehtahousing.com ઉપર પણ ઉપલબ્ધ રહેશે. બીએસઈના વેબસાઇટ ઉપર સંબંધિત વિભાગ www.bseindia.com ઉપર, જે સ્ટોક એક્ષચેન્જ જેના ઉપર કેંપની નોંધાયેલ છે તે અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ)ની વેબસાઇટ www.evoting.nsdl.com ઉપર પણ ઉપલબ્ધ રહેશે.

એમસીએ પરિપત્રો અનુસાર નોટિસની ભૌતિક નકલ, પોસ્ટલ બેલેટ ફોર્મસ અને પ્રિ-પેડ બિઝનેસ રિપ્લાય એનવેલપ્સ વેગેર આ પોસ્ટલ બેલેટ માટે આપવામાં આવતા નથી. સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાની મંજુરી કે નામંજુરી ઇ-વોટિંગના માધ્યમથી પ્રદાન કરે. જે સભ્યોના નામ કટ-ઓફ-ડેટ નવેમ્બર ૨૯, ૨૦૨૪ના રોજ સભ્યોનું રજીસ્ટર/ લાભાદાયી માલિકોના લિસ્ટમાં નોંધાયેલ છે, તેઓ જ આ નોટિસમાં જણાવેલ ઠરાવો પાસ કરવા મત આપવા માટે પાત્ર ગણાશે. જે સભ્યો કટ-ઓફ-ડેટના રોજ કંપનીના સભ્યો નથી તેઓ આ નોટિસને માત્ર માહિતીના હેતુથી સંદર્ભ લેશો.

રિમોટ ઇ-વોટિંગ સમયગાળા દરમિયાન સભ્યો પોતાનો મત ઇલેકટ્રોનિક રીતે આપી શકે તેવી સુવિધા સભ્યોને પ્રદાન કરવાના હેતુથી કંપની એનએસડીએલ

	ઇ-વોટિંગ શરૂ થવાનો સમય અને તારીખ	શુક્રવાર, ડિસેમ્બર ૦૬, ૨૦૨૪, ભારતીય સમય સવારે ૯-૦૦ ક્લાકે	
	ઇ-વોટિંગ સમાપ્ત થવાનો સમય અને તારીખ	શનિવાર, જાન્યુઆરી ૦૪, ૨૦૨૫, ભારતીય સમય સાંજે ૫-૦૦ ક્લાકે	
		•	

રિમોટ ઇ-વોટિંગ શનિવાર, જાન્યુઆરી ૦૪, ૨૦૨૫ ભારતીય સમય સાંજે ૫-૦૦ ક્લાક બાદ ઇ-વોટિંગ કરી શકાશે નહીં. અને એનએસડીએલ દ્વારા

સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પાતોના ઇ-મેલ આઈડીને નોંધાવે / અપડેટ કરાવે સંબંધિત ડિપોઝીટરા પાર્ટિસિપન્ટસ પાસે. નોંધણી /અપડેટ કરાવવામાં જો કોઈ તકલીફ કે મુંજવણ હોય તો સભ્યો ઇ-મેલ mehtahousingfinanceltd@gmail.com/ support@purvashare.com પર લખી મોકલી શકે છે.

પોસ્ટલ બેલેટ પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શી તરીકે હાઠ ધરવા માટે કંપનીએ સ્ક્રૂટિનાઇઝર તરીકે એમએસ.પિન્કી શેઠિયા (એસીએસ ૨૯૨૩૭ : સીઓપી ૧૭૩૪૪), પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરીને નિયુક્ત કરી છે.

પોસ્ટલ બેલેટ દ્વારા ઇ-વોટિંગનું પરિણામ સોમવાર, જાન્યુઆરી ૦૬, ૨૦૨૫ પહેલાં કંપનીની રજીસ્ટર ઓફિસ પ્લોટ નં.૧એ, રેવન્યુ સર્વે નં.૨૦૩, સાવરકુંડલા રોડ, તવેડા, મહુવા, ભાવનગર-૩૬૪૨૯૦, ભારત ખાતે જાહેર કરવામાં આવશે. આ ઠરાવ જો જરૂરી બહુમતી દ્વારા પસાર થાય તો એવું માનવામાં આવશે કે શનિવાર, જાન્યુઆરી ૦૪, ૨૦૨૫ ઇ-વોટિંગ માટે કંપનીએ જાહેર કરેલી છેલ્લી તારીખે છે. પરિણામો કંપનીની વેબસાઇટે www.mehtahousing.com તથા એનએસડીએલની વેબસાઇટ www.evoting.nsdl.com ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે.

કોઈપણ પ્રશ્નો / ફરિયાદોના કિસ્સામાં www.cvoting.nsdl.com ઉપર ઉપલબ્ધ શેરધારકો માટે અને શેરધારકો માટે ઇ-વોટિંગ માર્ગદર્શિકાના ડાઉનલોડ વિભાગમાં જણાવેલ વારંવાર પુછાતા પ્રશ્નો (એકએક્યુ)નો સંદર્ભ લેશો. અથવા ફોન ૦૨૨ - ૪૮૮૬ ૭૦૦૦ પર કરી શકો છો અથવા શ્રીમાન હાર્દિકકુમાર ઠક્કરને વિનંતી લખી hardikkumart@nsdl.com or evoting@nsdl.com ઉપર મોકલી શકો છો

> બોર્ડના આદેશ દ્વારા મહેતા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ માટે વિશાલ રૂપારેલ

> > મેનેજીંગ ડિરેક્ટર ડીન : ૦૦૦૭૭૭૬૭

## ભરૂચના નેત્રંગ ખાતે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ આવી પહોંચતા ભરૂચ ના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે ઉષ્માભેર સ્વાગત કરાયું પ્રસ્થાન કરાવતા આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

આજે ગામે ગામ અને ઘરે ઘરે માળખાકીય સુવિધાના કામો તેમજ વ્યકિતગત યોજનાના લાભો આદિવાસી સમાજને મળી રહ્યા છે - સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા

ભરૂચ

ભારત સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ આદિવાસી જનજાતિય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં તા.૧૫ નવેમ્બરના રોજ ઉજવાયા બાદ તેના ભાગરૂપે પીએમ-જનમન અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનને સાંકળી આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રા ૨૦૨૪ આજ રોજ નેત્રંગ ખાતે આવી પહોંચ્ચી હતી. આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રા આવી પહોંચતા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૧૫ નવેમ્બરે ધરતી આબા વધુમાં કહ્યું કે, સરકારે જંગલની જનજાતિય ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ જમીનના હકો - અધિકારો આપવાનું કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત કામ કર્યું છે. જમીનના અધિકારો પૂરતું આદિવાસી સમાજને આરોગ્ય, શિક્ષણ અને રોજગાર સહિતની માળખાકીય સુવિધા ઉપલબ્ધ થાય અને સર્વાંગી થાય તે માટે મહત્વની સેવા આપવા માટે આ ગૌરવરથ આવ્યો છે.

વિકાસની મુખ્યધારા સાથે જોડી સરકારની યોજનાઓ પહોંચી રહી છે. આદિવાસી સમાજની જીવનશૈલી બદલી છે. ઉમરગામથી અંબાજી સુધી રાજ્યના ૧૧ જિલ્લાના ૫૩ કરવા સરકારની વિવિધ યોજનાનો તાલુકામાં આ રથ ફરી રહ્યો છે. ધરતી લાભ લઈ વિકાસની આ વણથંભી આબા જનજાગૃતિ ગામ ઉત્કર્ષ યાત્રામાં સહભાગી બનીએ એવો અભિયાન અંગે સાંસદ શ્રી એ વધુમાં અનુરોધ કર્યો હતો. આ તકે, જણાવ્યું કે, આદીવાસીઓના ઉત્કર્ષ ભગવાન બીરસા મુંડાના જીવન માટે અનેક પ્રકારની કલ્યાણકારી કવનમાંથી પ્રેરણા લઈ તેમના યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ગુજરાત રાજ્યની ગુજરાત પેટર્ન શિક્ષિત, સંગઠીત, વ્યસન મુક્ત થવા યોજના થકી ગામને કઈ રીતે બેઠું કરી સમાજને હાંકલ કરી હતી. શકાય, કેવી રીતે સમૃદ્ધ બનાવી શકાય વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટીથી આગામી તેવા હેતુથી કાર્યરત કરાઈ છે. જેનો પાંચ વર્ષમાં રૂ. ૭૯ હજાર કરોડ લાભ આપણે સૌ લઈ રહ્યાં છે. અને દરેક આદિવાસી ગામના વિકાસ માટે વસ્તીને વિકાસ કાર્યોના લાભો



આવી છે. આજે ગામે ગામ અને ઘરે ઘરે માળખાકીય સુવિધાના કામો તેમજ વ્યકિતગત યોજનાના લાભો આદિવાસી સમાજને મળી રહ્યા છે. ચારે દિશામાં પ્રગતિ થઈ રહી છે. નહી પણ જમીન કેવી રીતે ખેતી લાયક બને તેને પ્રોત્સાહન આપવા ગુજરાત પેટર્ન અને વન વિભાગની પણ યોજનાઓ પણ અમલી છે. આમ, સરકાર પારદર્શી વહિવટ ચલાવી રહી સરકારે આદિવાસી સમાજને છે એટલે જ છેવાડના માનવી સુધી આપણે સૌ વડાપ્રધાનશ્રીના વિકસતિ ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર બલિદાનને યાદ કરી સમાજને રૂપિયાના ખર્ચે પાંચ કરોડ આદિવાસી

આપવામાં આવશે. તો એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાની નેમ સાથે આ અભિયાનને સાચા અર્થમાં સાર્થક બનાવવા સરકારની તમામ પ્રકારની કલ્યાણકારી યોજનાઓ બાકી રેહલા લોકો સુધી પહોચાડવા પ્રયત્નશીલ બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપશેએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. મહાનુભાવોના હસ્તે રથ ઉપર પુષ્પવર્ષા કરી આવકારવામાં આવ્યો હતો. સ્થળ પર વિવિઘ યોજનાકીય વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના લાભોની જાણકારી માટેના પેમ્પ્લેટની વહેચણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વસુધાબેન વસાવા, ઉપ પ્રમુખશ્રી, બાંધકામ સમિતના ચેરમેન શ્રી રાયસીંગભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્યો, પ્રાંત અધિકારી સુશ્રી કે.વી. ગામીત , મામલતદાર શ્રી રિતેશ કોં કણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ. આઈ. પટેલ, સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત

આપ્યું છે. પેસા એક્ટ હેઠળ જમીનના હકો અને અને આવાસો આપી કેન્દ્ર સરકાર દ્વારા બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારની પ્રેરણાથી સુરત જિલ્લાના માંડવીથી બિરસા મુંડાના ત્યાગ અને

બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી-૨૦૨૪ માંડવી ખાતેથી આદિવાસી અમૃત્તકુંભ મહોત્સવ રથયાત્રા-૨૦૨૪ને

આદિજાતિના સર્વાંગી વિકાસ માટે બીજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ

રોપ્યા છેઃ કેન્દ્ર સરકારે આઝાદીના જંગમાં આગવું યોગદાન આપનાર

બિરસા મુંડાને દેશના ઈતિહાસમાં આદરભર્યું સ્થાન અપાવ્યું છે

આદિવાસી અમૃત્તકુંભ મહોત્સવ રથયાત્રાને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રીશ્રી ભગવાન બિરસા મુંડાએ ''જય કુંવરજીભાઈ હળપતિએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. વિવિધ ગામોમાં આ યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. અને સરકારની વિવિધ પહેલો, યોજનાઓથી માહિતગાર કરી લોકો ૧૦૦ ટકા લાભાન્વિત તેમજ જાગૃત સ્થાન અપાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ થાય એવા પ્રયાસો કરાશે. આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ ૮૦ હજાર કરોડ ફાળવ્યા છે. મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યુ કે, આદિવાસી પ્રજા પ્રકૃતિ પૂજક છે. વિપક્ષ ભાગલા પાડી રોજ કરવાની નીતિ કરી રહ્યા છે, તેમને જાકારો આપીએ. , કેટલાક લોકો આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે તે લોકોને ઓળખવાની જરૂર છે. ગ્રામ પંચાયતના સરપંચના પદથી લઈને ભારતના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિના કર્યું હતું. યાત્રા દરમિયાન સરકારની પદ પર આદિવાસી સમાજ જોવા વિવિધ યોજના તેમજ આદિવાસી મળી રહ્યો છે. શ્રી હળપતિએ કહ્યું કે, આદિવાસી સમાજના વિકાસ માટે ઔષધિઓના સ્ટોલ ગોઠવવામાં આવ્યા સૌથી મોટુ બજેટ રાજ્ય સરકારે હતા.

આદિવાસી સમાજને સન્માન આપવાનું કામ સરકારે કર્યુ છે. બલિદાનનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે, અંગ્રેજો સામેની લડતમાં જોહાર કા નારા હે, ભારત દેશ હમારા હે''નો નારો આપ્યો હતો જ્યારે આપણા વડાપ્રધાનશ્રીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતનો નારો આપ્યો છે. કેન્દ્ર સરકારે આઝાદીના જંગમાં આગવું યોગદાન આપનાર બિરસા મુંડાને દેશના ઈતિહાસમાં આદરભર્યું આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે રૂ. આદિજાતિના સર્વાંગી વિકાસ માટે બીજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રોપ્યા છે. મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના કલાકારો દ્વારા ભવાડા નૃત્ય, તુર નૃત્ય, મેવાસી નૃત્ય, કાહાડી નૃત્ય, ઘૈરેયા નૃત્ય અને ડોબરૂ નૃત્ય રજૂ કરાયા હતા. મંત્રીએ બિરસા મુંડાની પ્રતિમાને ફ્લહાર કરી પૂજન સમાજની ખાદ્ય સામગ્રી અને

સ્થળ : મહુવા તારીખ : ડિસેમ્બર ૦૪, ૨૦૨૪

**FINANCIAL EXPRESS** 

## COURT DUE TO RULE ON LAW BANNING TIKTOK'S FOREIGN OWNERSHIP

# TikTok ruling in focus for Meta, Alphabet and Oracle investors

Adverse order may favour social media, search stocks

**FELICE MARANZ** December 5

**TECH INVESTORS ARE** girding for the latest development in TikTok's legal saga. Social media and search companies like Meta Platforms Inc. have a lot at stake, as does Oracle Corp., which counts TikTok as a big customer.

The US Court of Appeals in Washington is due to issue a ruling on whether to uphold or overturn a law that requires Tik-Tok's China-based owner to sell the app by Jan. 19, or face a ban in the US. The ruling probably won't be the end of the drama, as any outcome would likely be appealed.But traders are watching every step carefully, with Tik-Tok's more than 170 million US users and billions of dollars in advertising revenue top of mind.

**LEGAL SAGA** 

US court to rule on TikTok's sale or US ban by Jan 19

■ TikTok ban may benefit Meta, Alphabet, Pinterest, & Snap

■ Meta's Reels and Pinterest's shopping features could gain

For investors in companies like Instagram parent Meta, Google parent and YouTube ownerAlphabetInc.,andsmaller rivals like Pinterest Inc. and Snap Inc., a result that weakens TikTok would be a big positive. The company, owned by ByteDance Ltd., is used by about a third of US adults—and a majority of Americansunder 30 — and is growing more rapidly than competitors, according to Pew Research Center surveys.

Upholding the law would be a "clear victory for Meta shares,"

■ Oracle risks losing \$800M annually if TikTok is banned

according to Matt Stucky, chief

equity portfolio manager at

Northwestern Mutual Wealth

Management. Consensus esti-

mates have baked in TikTok

competition through 2026,

offering "all upside" for Meta

stock, Stucky said. Meta's Insta-

gram features a TikTok rival

70% this year, hit an intraday

record in Thursday morning

more user attention if TikTok

Meta, which is up more than

Pinterest may also capture

product known as Reels.

legal solutions ■ ByteDance refuses to sell TikTok despite US pressures were out of the picture, accord-

Appeals or

action could

■ TikTok may

survive with

Supreme Court

delay resolution

"Project Texas" or

ing to Stucky. It's been making a push into shoppable content, competing with similar efforts from TikTok and Instagram. Tik-Tok said this week that it tripled its US shopping sales to more than \$100 million on Black Fri-

Pinterest shares have had a volatile year, slumping in the summerafterpoorresultsbefore garnering some positive analyst attention a few months later. A weak sales forecast for the holiday quarter took that shine off,

The cricket fever in India did

not fail to surprise, with 7 bil-

lion views generated by content

leaving the stock down 12% this year. Snap is also having a rough year, with a decline of more than 4% in early Thursday trading pushing the shares down 28% year-to-date.

SRIRAM VEERA

Adelaide, December 5

**FOR THE PAST** few days, Rohit

Sharma and his men have been

the river Torrents. It is a simple

pleasure that they can't

indulge in India. Even here, if

anyone stops them for a selfie,

it's the Indian-origin fan. They

cross the road, walk past the

around 38-40 degrees, so hot

that the Aussies wrapped up their

optional net session within 20

India, before the birth of his sec-

ond child, Rohit was moping

around alone in the dressing

room at the Wankhede Stadium.

Histeammates had left, the Kiwis

were celebrating politely in the

room next door, and Rohit sat

ruminating.Suddenly,things stir

and change dramatically. He becomes a father again, and even

as he is "holding the baby in my

hands", his team is thumping the

Aussies. On his flight to Perth, he

asks for an internet connection to

check the match scores. By the

timehelands, Virat Kohli is blast-

ing the ball to all around the park.

Sometimes, a week can be really

on the 2011-12 tour, he was fac-

ing selection dejection, unable to

make his Test debut. Two days

before the Sydney Test, he even

attended a press conference. Usu-

ally, it meant back then that he

might play. He would talk about

"I would know tomorrow if I am

playing". He didn't. Coming after

a year when he missed the ODI

World Cup, his life and career

must have seemed like spiralling

Express a couple of years ago, he

talked about how all the develop-

In a chat with The Indian

out of his control.

Twelve years ago in Australia,

long and action-packed.

A couple of weeks ago, in

minutes and fled.

Social Media Stocks Have Had a Mixed Year | Meta has soared while Pinterest and Snap are lower

There's also upside for Alphabet, though to a lesser extent, said Stucky. The main benefit would bevia search, where Google faces a lot of competition — primarily from ChatGPT.

On the flip side, if TikTok is ultimately banned in the US, it would be negative for Oracle, which provides the social media app with cloud infrastructure to store and process US user data. Oracle said in June that a ban would threaten its financial results, and Evercore ISI estimated that TikTok may account for as much as \$800 million of annual sales. Shares in the software firm have been on a tear this year, rising almost 80%.

- BLOOMBERG

## walking to the stadium from their hotel across a bridge over DREAM statue of Clem Hill, a legendary cricketer from these parts, at the stadium entrance and breeze through the sliding glass doors into the arena. Thursday was a particularly burning day in Adelaide, temperatures hovering

ments in that period made him almost detest the "talented" label. "Kuch matlab nahi hai yaar, that word ka" (It has no meaning). What does it even mean? You have to perform." Eventually, he would get the chances but he wasn't consistent. Especially in Tests. Then suddenly Ravi Shastri as coach, and Virat Kohli as captain offered him the chance to open in Tests.

Why the series matters

beyond the results

for Rohit and Cummins

Shastri once told this newspaper about making Rohit the opener."I had already told him but he wasn't sure. Then one day, finally, he agreed. I knew he had it in him but he worked his bloody a\*\*\* off to make it work." Shastri would know, after converting into an opener from the lower order. But Shastri's game, in a sense, was almost suited for the role. Rohit's wasn't. He made tweaks in as basic aspects as how he gripped the bat. It hurt his wrists, but he did it for hours together for days to make it a muscle memory. The bat that would flash outside off had to be controlled, and since 2018, he had turned into a classical Test opener. Until recently, in his attempt to set the agenda for the team, he had become a tad too

adventurous as an opener.

Now he has to quit that role. He had to make that decision too. "It was an easy decision as a team (to make KL Rahul open at Adelaide), not easy for me (as a player), but very easy for the team," he said, smiling, on Thursday.

### In search of love

Not that he would care, but the four remaining Tests would also determine Rohit's relationship with Australia. He is a star in India. England too saw the best of him in 2018 as an opener. But in Australia, where he did play important knocks in 2018-19 doesn't quite have a relationship with him.

Ahead of the series, various media in Australia ran promotions. Some even used Hindi and Punjabi.Kohli's facewas splashed all over the papers and television. Rohit was hardly mentioned That Australia's marketing wigs didn't think Rohit's face would be a star attraction in Australia was intriguing. Australia has always been like this. In India, we might rate and rave about cricketers performing in other countries, but the Aussies' respect comes almost only when the players score consistently in their

### Ambani wedding among top YouTube trends in 2024 PRESS TRUST OF INDIA on the list was singer and actor

Gaming, who commands an

impressive subscriber count of

43.9 million, also grabbed a

which quickly gained popular-

ity for its entertaining tone and

catchy melody, has been fea-

tured in numerous videos, gar-

nering over 4.5 billion views, it

The song "moye moye,"

spot on the charts.

New Delhi, December 5

THE BIG FAT Indian wedding of Radhika-Anant Ambani, cricket lovers' festival IPL, gamer Ajju bhai -- whose amusing commentary entertained audiences -- and 'moye moye', a catchy melody by a Serbian artist that internet users widely used to take a funny take on adversities, grabbed spots in the chart of most-trending topics on YouTube in 2024. Indian creators and fans on

YouTube didn't just break the internet, but rebuilt it with their unique voice and brand of creativity, YouTube said in its India blog on Thursday, which revealed the top trending takeaways of the year.

Videos featuring "Ambani" and "wedding" in their titles amassed over 6.5 billion views in India, as fans analysed every

please visit www.apdcl.org

aspect of the event, including international performances, stunning outfits, and a guest list filled with celebrities, according to the blog.

"From armchair fashion critics to wedding planners offering their hot takes, this year, the after-party was online, and everyone had a VIP pass, YouTube wrote.

Sd/- Chief General Manager (F&A)

APDCL, Paltanbazar, Guwahati - 1

Type of Resolution

Special Resolution

Special Resolution

(A Govt. of Assam Public Limited Company)

NOTICE FOR ENGAGEMENT OF POINT OF PRESENCE (POP)-

NATIONAL PENSION SYSYEM (NPS) FOR APDCL

APDCL is going to engage Point of Presence (PoP) for National Pension

System (NPS). In this regard, interested and eligible PoPs are invited

to submit their Expression of Interest (EOI) along with relevant

documents. The EOIs must be submitted within 7 working days from

the EOIs and will shortlist the PoPs for presentation. The EOI may be

the date of publication of this advertisement. APDCL will evaluate 9

submitted to the office of the Chief General Manager (F&A), APDCL, &

6<sup>th</sup> Floor, Bijulee Bhawan, Paltanbazar, Guwahati-781001. For details, ≦

Please pay your energy bill on time and help us to serve you better!

MEHTA HOUSING FINANCE LIMITED

Regd. Off. Plot No. 1A, Revenue Survey No 203, Savarkundia Road,

Taveda, Mahuva Bhavnagar, Gujarat - 364290

CIN: L15100GJ1993PLC020699 M: 98989 08652 Email: mehtahousingfinanceltd@gmail.com Website: www.mehtahousing.com NOTICE OF THE POSTAL BALLOT AND INFORMATION ON REMOTE EVOTING

Notice is hereby given to the Members of Mehta Housing Finance Limited ("the Company"), pursuan

to Sections 108 and 110 of the Companies Act, 2013 ("the Act") read with Rule 20 and Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time

"Management and Administration Rules"), General Circular Nos. 09/2024 dated September 19

2024 and other relevant circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") from time to time

"MCA Circulars") and Regulation 44 of the Securities and Exchange Board of India ("SEBI") (Listing

Obligations and Disclosure Requirements) Regulations, 2015, ("Listing Regulations") and other

applicable provisions of the Act, Listing Regulations, rules, circulars and notifications issued thereunde

including any statutory modification(s), clarification(s), substitution(s) or re-enactment(s) thereof to

the time being in force), for passing the following resolutions as Special Resolution by means of posta

The Company completed the dispatch of Notice of Postal Ballot along with Explanatory Statement

on December 04, 2024 via E-mail to all members of the Company, who have registered their e-mail

address with the Registrar and share Transfer Agent (RTA) of the Company viz., Purva Sharegistry

(India) Pvt. Ltd. and / or depository participant as on November 29, 2024 (Friday) i.e. cut-off date.

The said Notice will also be made available on the website of the Company i.e. on

www.mehtahousing.com, the relevant section of the website of BSE Limited ("BSE") i.e on

www.bseindia.com, stock exchange on which the Equity Shares of the Company are listed and on

As per the MCA Circulars, physical copies of the Notice, postal ballot forms and pre-paid Business

Reply Envelopes are not being sent to Members for this Postal Ballot. Members are requested to

the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

ballot, by voting through electronic means only ("remote e-voting"):

Alteration in the Memorandum of Association and the Articles of

Change in name of the Company

during the following period:

Ajju bhai, known as Total

related to the ICC Men's T20 World Cup and the 2024 Indian Premier League. "Creators stepped up to the crease, delivering expert

analysis, hilarious commentary, and mind-blowing recreations. Fans, on the other hand, didn't just jump into the conversation - they dissected every play, celebrated every victory, and turned those nailbiting javelin throws into YouTube gold.

"And, forget the nosebleed seats! Connected TVs gave viewers front-row access to the action, turning living rooms into fan-access zones," the blog

Another well-known name

Diljit Dosanjh, who has taken over social media feeds with his concert clips and electrifying performances. The 2024 Lok Sabha elec-

tions, veteran industrialist Ratan Tata who breathed his last on October 9, multi-starrer mythology movie Kalki 2898 AD also featured in the list.

'Gulabi Sadi', 'Teri Baaton Mein Aisa Uljha Jiya', 'Aaj ki Raat', and Vicky Kaushal's 'Tauba Tauba' emerged as the top songs on YouTube Shorts.

"As pop culture continues to become more personalised, fan-driven, and participatory, YouTube serves as a launchpad for new kinds of breakthrough entertainment and a place where viewers are coming to take part in larger cultural moments in new ways.

## KERALA WATER AUTHORITY e-Tender Notice

Tender No: 4 th Re- E-Tender No.WRD/KWA-CE(SR)/TR/4850/2022 26 12 11/RC1/1 Jal Jeevan Mission (JJM)-Karoor Panchayath. -Package 6 - Construction of Raw Water Pump House and Raw Water Pumping main-Pipeline Work. EMD: Rs 200000 Tender fee: Rs. 11025 Last Date for submitting Tender: 13-12-2024 03:00:pm Phone: 04812562745 Website: www.kwa.kerala.gov.in www.etenders.kerala.gov.in

KWA-JB-GL-6-905-2024-25

**Superintending Engineer** PH Circle Kottayam

Panabyte

#### PANABYTE TECHNOLOGIES LIMITED (Formerly known as Panache Innovations Limited)

CIN: L51100MH1981PLC312742 Registered & Corporate Office: Office No. 105, Primus Business Park, Plot No. A-195.

Road No. 16/A, Ambika Nagar No. 2, Wagle Industrial Estate, Thane - 400604, Maharashtra, India Tel: +91 8657641575; Email: info@panachemodera.com; Website: www.panabyte.com

### POSTAL BALLOT NOTICE AND E-VOTING INFORMATION Notice is hereby given that the Company is seeking approval of the Members of the Company

by way of postal ballot through remote e-Voting on the following resolutions. Type of Resolution

1	Appointment of Mrs. Chhaya Rajendra Bhonslay (DIN: 07133344) as an independent director of the company.	Special Resolution
2	Approval of the requests received for Re-classification of certain members of the Promoter and Promoter Group of the Company from 'Promoter Group' category to 'Public' category.	Ordinary Resolution
	Postal Ballot Notice along with the instructions for remote e-vo	

is available on the website of the Company at www.panabyte.com, the website of Centra Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com being the agency appointed by the Company for providing e-voting facility for the Postal Ballot and on the website of the Stock Exchange on which the equity shares of the Company are listed i.e. BSE Limited In compliance with the provisions of the Companies Act, 2013, and the General Circular No(s) 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020 read with other relevant circulars issued in this regard, the latest being General Circular No. 09/2024 dated September 19, 2024

(collectively referred to as 'MCA Circulars'), the Company has completed sending the Notice

as on Thursday, December 05, 2024, ONLY through electronic mode, to those Members whose

e-mail addresses are registered with the Company/Registrar and Transfer Agent/Depository Participants and whose names are recorded in the Register of Members of the Company or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Friday, November 22, 2024 ('Cut-Off Date'). Accordingly, physical copy of the Notice along with Postal Ballot Form has not been sent to the Members for this Postal Ballot. The Company has engaged the services of CDSL to provide remote e-Voting facility to its Members. The remote e-Voting period commences on Friday, December 06, 2024, from 9:00 a.m. (IST) and ends on Saturday, January 04, 2025, at 5:00 p.m. (IST). The remote e-Voting module shall be disabled by CDSL thereafter and casting of votes will not be allowed beyond Saturday, January 04, 2025, at 5:00 p.m. (IST). Voting rights of the Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on the Cut-Off Date. Once vote on a resolution is cast, the Member(s) will not be able to

change it subsequently, please note that communication of assent or dissent of the Members

would only take place through the remote e-Voting system. Only those Members whose names

are recorded in the Register of Members of the Company or in the Register of Beneficial Owners

maintained by the Depositories as on the Cut-off date will be entitled to cast their votes by remote The Board of Directors of the Company has appointed Mr. Dharmesh Zaveri (Membership No. FCS 5418, CP No. 4363) of D. M. Zaveri & Co., Practising Company Secretaries, as the Scrutinizer to scrutinize the postal ballot process in fair and transparent manner. The Scrutinizer have consented to act as Scrutinizer for this postal ballot.

The Scrutinizer will submit his report to the Chairman, or any other person authorized by him after scrutiny of the votes cast for the Postal Ballot through remote e-Voting, within two working days from the conclusion of the remote e-Voting period for the postal ballot. The Scrutinizer's decision on the validity of votes cast will be final. The results of the Postal Ballot through remote e-Voting along with the Scrutinizer's Report ('Result') will be made available on the website of the Company at www.panabyte.com and on the website of CDSL at www.evotingindia.com and intimated to BSE Limited, within two working days from the conclusion of the remote e-Voting period for the postal ballot. Additionally, the Result will also be placed on the notice board of the Company at its Registered Office.

The Members who have not registered/updated their Email Ids so far are requested to register/update the same to get all notice, communications, etc. from the Company electronically as per the following procedure : a) Incase of demat/electronic holding : Contact respective Depository Participants. b) Incase of physical shareholding: Contact either RTA by sending an email at nichetechpl@nichetechpl.com or the Company by sending the email to compliance@panachemodera.com by quoting the name and folio number

For details relating to e-voting, please refer to the postal ballot notice. For any grievances connected with facility for e-voting, please contact- Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or e-mail helpdesk.evoting@cdslindia.com, Toll Free No : 1800 21 09911.

The Resolutions, if passed by the requisite majority through Postal Ballot by remote e-Voting will be deemed to have been passed on the last date specified for e-Voting i.e., Saturday January 04, 2025. For Panabyte Technologies Limited

> (Formerly known as Panache Innovations Limited) Harshada Mohite Company Secretary & Compliance Officer

### VIRINCHI LIMITED Regd office: 8-2-672/5 & 6, 4th Floor, Ilyas Mohammed Khan Estate,

Road No. 1, Banjara Hills, Hyderabad-500 034, Telangana. Tel: 040 4372 8111 Email id: investors@virinchi.com Website: www.virinchi.com CIN: L72200TG1990PLC011104

NOTICE OF POSTAL BALLOT

Notice is hereby given pursuant to Section 108, Section 110 and other applicable

provisions, if any, of the Companies Act, 2013 ("the Act") read with Rule 20 and 22 of the ompanies (Management and Administration) Rules, 2014, read with General Circular No 4/2020 dated April 8, 2020, the General Circular No. 17/2020 dated April 13, 2020, the eneral Circular No. 22/2020 dated June 15, 2020, the General Circular No. 33/2020 dated September 28, 2020, the General Circular No. 39/2020 dated December 31, 2020, Genera Circular No. 02/2021 dated January 13, 2021, the General Circular No. 10/2021 dated June 23, 2021, the General Circular No. 20/2021 dated December 8, 2021, the General Circula No. 03/2022 dated May 5, 2022, the General Circular No. 11/2022 dated December 28 2022, General Circular No. 09/2023 dated September 25, 2023 and General Circular No. 09/2024 dated September 19, 2024 issued by Ministry of Corporate Affairs ("MC. Circulars\*), and SEBI Circular dated January 05, 2023, October 07, 2023 and October 03 2024 read with Regulation 44 of the Securities and Exchange Board of India (Listin Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standards of General Meetings (SS-2) including any statutory modification or re-enactment thereof for the time being in force and pursuant to other applicable laws and regulations, that th Resolution is proposed to be passed by the Members of the Company through Postal Ballot by remote e-voting process ("E-Voting") for seeking approval of Members of the Compan

O.Hu.	operior resolution	-
11.55	Approval of Virinchi Employees Stock Option Scheme, 2024 ("VESOS, 2024") and Grant of Employees Stock Options to employees of the Company thereunder.	
2.	Grant of Employee Stock Options to the Eligible Employees of the Subsidiary(ies) of the Company under Virinchi Employees Stock Option Scheme, 2024.	2
3.	To Approve Grant of options to equal to or exceeding one per cent but not exceeding four per cent of the issued Capital of the Company during any one financial year to identified employees under Virinchi Employees Stock Option Scheme, 2024 (VESOS, 2024).	3
	The state of the s	10

with the Login ID and password to the Members for e-voting who have registered their e-mai id's with Depository Participant(s) or with the Company.

The Board of Directors of the Company has appointed Mr. Vinay Babu Gade, Company Secretary in Practice as the Scrutinizer for conducting the Postal Ballot process.

On Thursday, December 05, 2024, the Company has sent the Notice of Postal Ballot along

Members are requested to provide their assent or dissent through e-voting only. The Company has appointed Central Depository Services (India) Limited (CDSL) for providing e-voting facility to enable the Members to cast their votes electronically. The detailed procedure for e-voting is provided in the Note No. 12 of the Notice of Postal Ballot Members are requested to note that the e-voting shall commence from 9:00 a.m. (IST) on Friday, December 06, 2024 and end on 5:00 p.m. (IST) on Saturday, January 04, 2025. The e-voting module shall be disabled by CDSL for voting thereafter. In accordance with the above mentioned Circulars, physical copies of the Notice of Postal

Ballot along with Postal Ballot Forms and Pre-paid Business Reply Envelope will not be sent to the Members. The communication of the assent or dissent of the Members would take place through the remote e-voting system only. The voting rights of Members shall be reckoned as on Friday, November 29, 2024, which is

the cut-off date. A person who becomes a Member after the Cut-off date shall treat this notice for information purpose only. The copy of the Postal Ballot Notice is available on the Company's website at www.virinchi.com, website of the Stock Exchange i.e., BSE Limited www.bseindia.com and NSE Limited - www.nseindia.com and on the website of CDSL at https://www.evotingindia.com/. Members who have not received the Postal Ballot Notice may download it from the above mentioned websites or write to the Company at Please note that the voting beyond 5:00 PM (IST) on Saturday, January 04, 2025 will not be

valid and also shall not be allowed beyond the said date. Members holding shares in physical mode and who have not updated their email addresses

with the Company are requested to update their email addresses by writing to the Company or RTA at investors@virinchi.com, info@aarthiconsultants.com along with the copy of the signed request letter mentioning the name and address of the Member, self-attested copy of the PAN card and self-attested copy of any document i.e., Driving License or Election Identity Card or Passport or Aadhar Card in support of the address of the Member. Members holding shares in dematerialised mode are requested to register / update their email addresses with the Depository Participants with whom they are maintaining Demat Accounts. In case of any queries / difficulties in registering the e-mail address, Members may write to investors@virinchi.com. The resolution if approved shall be deemed to have been passed on the last date of e-voting

i.e., Saturday, January 04, 2025. The result of Postal ballot e-voting will be announced on or before Tuesday, January 07, 2025 and will be displayed on the Company's Website www.virinchi.com and communicated to BSE Limited and NSE Limited. The Company will also display the results of Postal Ballot at its Registered Office. Mr. K Ravindranath Tagore, Company Secretary, Virinchi Limited, Regd. Off: -2-672/5&6

4th Floor, Ilyas Mohammed Khan Estate Road No.1, Banjara Hills, Hyderabad- 500034. Telangana, email: investors@virinchi.com, Ph. No. 040-43728111, is responsible to address the grievances connected with the E-voting and Postal Ballot. For Virinchi Limited

> K. Ravindranath Tagore Company Secretary

## VIVO BIO TECH LIMITED

Regd. Off: 3rd Floor, Ilyas Mohammed Khan Estate. #8-2-672/5&6, Road No.1, Baniara Hills Hyderabad - 500034, Telangana, India. Ph.No. 040-23313288 Email ID: investors@vivobio.com; website: www.vivobio.com

> CIN: L65993TG1987PLC007163 NOTICE OF POSTAL BALLOT

lotice is hereby given pursuant to Section 108, Section 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("the Act") read with Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014, read with General Circular No 14/2020 dated April 8, 2020, the General Circular No. 17/2020 dated April 13, 2020, the General Circular No. 22/2020 dated June 15, 2020, the General Circular No. 33/2020 date September 28, 2020, the General Circular No. 39/2020 dated December 31, 2020. Genera Circular No. 02/2021 dated January 13, 2021, the General Circular No. 10/2021 dated Jun 23, 2021, the General Circular No. 20/2021 dated December 8, 2021, the General Circular No. 03/2022 dated May 5, 2022, the General Circular No. 11/2022 dated December 28 2022, General Circular No. 09/2023 dated September 25, 2023 and General Circular No. 09/2024 dated September 19, 2024 issued by Ministry of Corporate Affairs ("MCA Circulars\*), and SEBI Circular dated January 05, 2023, October 07, 2023 and October 03 2024 read with Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standards or General Meetings (SS-2) including any statutory modification or re-enactment thereof for the time being in force and pursuant to other applicable laws and regulations, that the Resolution is proposed to be passed by the Members of the Company through Postal Ballo by remote e-voting process ("E-Voting") for seeking approval of Members of the Company

22	2024") and Grant of Employees Stock Options to employees of the Company thereunder.
	Grant of Employee Stock Options to the Eligible Employees of the Subsidiary(ies) of the Company under Vivo Bio Employees Stock Option Scheme, 2024 ("VBESOS, 2024").

To Approve Grant of options to equal to or exceeding one per cent but no exceeding four per cent of the issued Capital of the Company during any one

Approval of Vivo Bio Employees Stock Option Scheme, 2024 ("VBESOS

financial year to identified employees under Vivo Bio Employees Stock Option Scheme, 2024 ("VBESOS, 2024"). On Thursday, December 05, 2024, the Company has sent the Notice of Postal Ballot along with the Login ID and password to the Members for e-voting who have registered their e-

mail id's with Depository Participant(s) or with the Company The Board of Directors of the Company has appointed Mr. Vinay Babu Gade, Company

Secretary in Practice as the Scrutinizer for conducting the Postal Ballot process. Members are requested to provide their assent or dissent through e-voting only. The Company has appointed Central Depository Services (India) Limited (CDSL) for providing

procedure for e-voting is provided in the Note No. 12 of the Notice of Postal Ballot. Members are requested to note that the e-voting shall commence from 9:00 a.m. (IST) on Friday, December 06, 2024 and end on 5:00 p.m. (IST) on Saturday, January 04, 2025. The e-voting module shall be disabled by CDSL for voting thereafter. In accordance with the above mentioned Circulars, physical copies of the Notice of Postal

e-voting facility to enable the Members to cast their votes electronically. The detailed

Ballot along with Postal Ballot Forms and Pre-paid Business Reply Envelope will not be sent to the Members. The communication of the assent or dissent of the Members would take place through the remote e-voting system only. The voting rights of Members shall be reckoned as on Friday, November 29, 2024, which is

notice for information purpose only. The copy of the Postal Ballot Notice is available on the Company's website at www.vivobio.com, website of the Stock Exchange i.e., BSE Limited at www.bseindia.com and on the website of CDSL at https://www.evotingindia.com/. Members who have not received the Postal Ballot Notice may download it from the above mentioned websites or write to the Company at <a href="mailto:investors@vivobio.com">investors@vivobio.com</a>. Please note that the voting beyond 5:00 PM (IST) on Saturday, January 04, 2025 will not be

the cut-off date. A person who becomes a Member after the Cut-off date shall treat this

valid and also shall not be allowed beyond the said date.

Members holding shares in physical mode and who have not updated their email addresses with the Company are requested to update their email addresses by writing to the Company or RTA at investors@vivobio.com, info@aarthiconsultants.com along with the copy of the signed request letter mentioning the name and address of the Member, self-attested copy of the PAN card and self-attested copy of any document i.e., Driving License or Election Identity Card or Passport or Aadhar Card in support of the address of the Member. Members holding shares in dematerialised mode are requested to register / update their email addresses with the Depository Participants with whom they are maintaining Demat Accounts. In case of any queries / difficulties in registering the e-mail address, Members may write to investors@vivobio.com.

The resolution if approved shall be deemed to have been passed on the last date of e-voting e., Saturday, January 04, 2025. The result of Postal ballot e-voting will be announced on or before Tuesday, January 07, 2025 and will be displayed on the Company's Website www.vivobio.com and communicated to BSE Limited. The Company will also display the

results of Postal Ballot at its Registered Office. Mr. A V Kiran, Company Secretary, Vivo Bio Tech Limited, Regd. Off: 3rd Floor, Ilyas Mohammed Khan Estate, 8-2-672/5&6, Road No.1, Banjara Hills, Hyderabad - 500034, Telangana, India, email: investors@vivobio.com, Ph. No. 040-23313288, is responsible to

address the grievances connected with the E-voting and Postal Ballot.

For Vivo Bio Tech Limited A V Kiran

ICSI Membership No.: A73929

financialexp.epapr.in

Date: 05.12.2024

Place: Hyderabad

Place: Hyderabad Date: 05.12.2024 Company Secretary

Date: December 04, 2024

Place: Mahuva

Managing Director DIN: 00077767

provide their assent or dissent through e-voting only. The Members, whose names appear in the Register of Members / list of Beneficial Owners as on Friday, November 29, 2024, being the cut-off date, are entitled to vote on the Resolutions set forth in this Notice. A person who is not a member as on the cut-off date should treat this Notice of Postal Ballot for information purposes only. The Company has engaged NSDL for facilitating remote e-voting to enable the members to cast their votes electronically during the remote e-voting period. The remote e-Voting facility would be available

Friday, December 6, 2024, IST at 9.00 a.m.

Commencement of e-Voting Saturday, January 4, 2025, IST at 5.00 p.m. End of e-Voting E-voting shall not be allowed beyond Saturday, January 4, 2025, IST at 5.00 p.m. and the e-voting module shall be disabled thereafter by NSDL

Members are requested to register/update their e-mail addresses with relevant Depository Participants In case of any queries/ difficulties in registering the e-mail address Members may write to mehtahousingfinanceltd@gmail.com/ support@purvashare.com.

The Company has appointed Ms. Pinky Shethia (ACS 29237; COP 17344), Practicing Company Secretary, to act as a Scrutinizer, to conduct the Postal Ballot process, in a fair and transparent The results of the e-voting by Postal Ballot will be announced on or before Monday, January 6, 2025, at the Registered office of the Company at Plot No 1A Revenue Survey No 203, Savarkundla Road,

Taveda, Mahuva Bhavnagar 364290, India. The Resolutions, if passed by requisite majority shall be deemed to have been passed on Saturday, January 4, 2025, being the last date specified by the Company for e-voting. The results will also be made available on the website of the Company i.e. www.mehtahousing.com and on the website of NSDL at www.evoting.nsdl.com. In case of any queries/grievances, you may refer the Frequently Asked Questions (FAQs) for

Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on: 022 - 4886 7000 or send a request to Mr. Hardikkumar Thakkar at HardikkumarT@nsdl.com or evoting@nsdl.com. By the order of the Board For Mehta Housing Finance Limited

Vishal Ruparel

Place: Thane Date: December 05, 2024